



# સાવજ બ્યુવેરીયા

## ચુસીયા તેમજ ઈયળોનું અસરકારક જૈવિક કીટનાશક

સાવજ બ્યુવેરીયા એ ફૂગ આધારિત જૈવિક કીટનાશક છે. કપાસ, મગફળી, દિવેલા, તુવેર, ધાણા, જરૂ, ચાણા, મજા, અળદ, લસણ, તુંગણી જેવા પાકોમાં આવતી ઈયળો અને ચુસીયા પ્રકારની જીવાતોમાં રોગ પેદા કરી તેનું અસરકારક નિયંત્રણ કરે છે. સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ (૧ કિલો પાવડરમાંથી ૧૨ પંપ કરવા) પ્રમાણે ૧૦ થી ૧૫ દિવસના અંતરે બે કલાક પાણીમાં પલાણ્યા પછી સાંજના સમયે તાપ ઓછો હોય ત્યારે જરૂરિયાત મુજબ સ્ટીકર સાથે ભેળવી છોડ પુરેપુરો પલણી જાય તેમ છંટકાવ કરવો.

### ❖ ચુસીયા જીવાતોનું નિયંત્રણ:



તડતડીયા



મોલોમશી



થ્રીપ્સ



મીલીબગ

મોલોમશી, થ્રીપ્સ, તડતડીયા, મીલીબગ, પાન કથીરી, આંબાનો મધીયો વગેરેના નિયંત્રણ માટે સાવજ બ્યુવેરીયા સાથે રાસાયણિક દવાઓ ભલામણા કરતા અદ્ધા ડોઝમાં ભેળવીને નીચે જણાવેલ કમ અથવા સેડયુલ પ્રમાણે જરૂરિયાત મુજબ છંટકાવ કરી શકાય.

- (૧) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે થાયોમીથોકઝામ ત થી ૪ ગ્રામ/પંપ.
- (૨) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ડીનોટેફચુરાન ત થી ૪ ગ્રામ/પંપ.
- (૩) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ડાયમીથોએટ ૧૦ થી ૧૫ મીલી/પંપ.
- (૪) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ઈમીડા કલોપ્રીડ ત થી ૪ મીલી/પંપ.
- (૫) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે કાર્બોસલ્ફન ૭ થી ૧૦ મીલી/પંપ.
- (૬) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે કાર્ટેપ હાઈડ્રોકલોરાઈડ ૭ થી ૧૦ ગ્રામ/પંપ
- (૭) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ફલોનીકામીડ ત મીલી/પંપ.

### ❖ સફેદમાખીનું નિયંત્રણ :

સફેદમાખીના નિયંત્રણ માટે સાવજ બ્યુવેરીયા સાથે રાસાયણિક દવાઓ ભલામણા કરતા અદ્ધા ડોઝમાં ભેળવીને નીચે જણાવેલ કમ અથવા સેડયુલ પ્રમાણે જરૂરિયાત મુજબ છંટકાવ કરી શકાય.



સફેદમાખી

- (૧) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ટ્રાયઝોફોસ ૧૦ થી ૧૫ મીલી/પંપ.
- (૨) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે એસીટામાપ્રીડ ૨ થી ૩ ગ્રામ/પંપ.
- (૩) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે બાયફેન્થ્રીન ૭ થી ૧૦ મીલી/પંપ.
- (૪) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ડાયફેન્થીયુરોન ૭ થી ૧૦ ગ્રામ/પંપ.
- (૫) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે સ્પાયરોમેસીફેન ૭ થી ૮ મીલી/પંપ.



સફેદ ધેણા

### ❖ જમીન જન્ય જીવાતો :

ધૈણ (મુંડા) ના નિયંત્રણ માટે સાવજ બ્યુવેરીયા અથવા સાવજ મેટારીજીયમ ૧ થી ૧.૫ કિલો પ્રતિ વિધા મુજબ ૫૦ કિલો એરંડીનાં ખોળ સાથે ભેળવી જમીનમાં ભેજ હોય ત્યારે વાવણી સમયે આપવું.

## ❖ ઈયળોનું નિયંત્રણ :



ગુલાબી ઈયળ, લીલી ઈયળ, લશકરી ઈયળ, હીરા ફૂદાની ઈયળ, ફળ અને કુંખ કોરીખાનાર ઈયળના નિયંત્રણ માટે સાવજ બ્યુવેરીયા સાથે રાસાયણિક દવાઓ ભલામણ કરતા અહધા તોઝમાં ભેણવીને નીચે જણાવેલ કમ અથવા સેડયુલ પ્રમાણે જરૂરિયાત મુજબ છંટકાવ કરી શકાય.

- (૧) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે કવીનાલફોસ ૧૦ થી ૧૫ મીલી/પંપ.
- (૨) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ઈન્ડોકાર્બ ૨ થી ૩ મીલી/પંપ.
- (૩) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે કલોરપાઇન્ફોસ ૧૦ થી ૧૫ મીલી/પંપ.
- (૪) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે નોવાલ્યુરોન ૧૦ થી ૧૫ મીલી/પંપ.
- (૫) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ડીરીવીપી ૫ થી ૭ મીલી/પંપ.
- (૬) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે થાયોડીકાર્બ ૫ થી ૭ ગ્રામ/પંપ.
- (૭) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે સ્પીનોસાડ ૨ થી ૩ મીલી/પંપ.
- (૮) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ફીપ્રોનીલ ૭ થી ૧૦ મીલી/પંપ.
- (૯) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે રીનેક્ષીપાયર ૨ મીલી/પંપ.
- (૧૦) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ફલુબેન્ડીયામાઇડ ૨ થી ૩ મીલી/પંપ.
- (૧૧) સાવજ બ્યુવેરીયા ૮૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે એમામેક્ટીન બેન્જોએટ ૩ થી ૪ ગ્રામ/પંપ.

## ❖ કાણજી : આ જૈવિક દવા ફૂગનાશક સાથે ભેણવવી નહીંની.

આ દવાનો સંગ્રહ સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં ન આવે તે રીતે અને ઠંડા વાતાવરણમાં કરવો.

## સાવજ ખાનડ જૈવિક ઉત્પાદનો નીચેના ફૃષ્ટ વિજ્ઞાન કેન્દ્રો પરથી પણ મળશે

કેન્દ્રનું નામ	ફોન નંબર
ફર્મ વિજ્ઞાન કેન્દ્ર - અમરેલી	૦૨૭૮૨-૨૨૭૧૨૨
ફર્મ વિજ્ઞાન કેન્દ્ર - જામનગર	૦૨૮૮-૨૭૧૦૧૬૫
ફર્મ વિજ્ઞાન કેન્દ્ર - તરઘડીયા (રાજકોટ)	૦૨૮૧-૨૭૮૪૧૭૦
ફર્મ વિજ્ઞાન કેન્દ્ર - નાના કાંધાસર (ચોટીલા)	૦૨૭૫૧-૨૮૪૧૨૦
ફર્મ વિજ્ઞાન કેન્દ્ર - પીપળીયા (ધોરાણ)	૦૨૮૨૪-૨૮૨૫૮૪
ફર્મ વિજ્ઞાન કેન્દ્ર - ખાપટ (પોરબંદર)	૦૨૮૬-૨૮૧૨૫૬૨
ફર્મ વિજ્ઞાન કેન્દ્ર - અંબુજા સિમેન્ટ ફાઉ. (કોડીનાર)	૦૨૭૮૫-૨૩૨૩૬૩

સાવજ ખાનડના અન્ય ઉત્પાદનો જેવાકે... **સાવજ ફેરોમેન ટ્રેપ** (ગુલાબી, લશકરી, લીલી અને રીંગાળાની કુંખ કોરીખાનાર ઈયળો માટે),

**સાવજ ફળમાખી ટ્રેપ** (ફળ પાકો અને શાકભાજી પાકો માટે), **સાવજ એસ.એન.પી.વી.** (લશકરી ઈયળ માટે),

**સાવજ એચ.એન.પી.વી.** (લીલી ઈયળ માટે), **સાવજ ટ્રાયકોકાઈ** (જુદી જુદી ઈયળોના દંડાના પરોપજીવી) ઉપલબ્ધ છે.

ડૉ. ડી. એમ. જેઠવા, શ્રી એમ. એ. કરકર, શ્રી એ. વી. કચોટ, ડૉ. પી. એસ. વડસ્કર અને ડૉ. એમ. એફ. આચાર્ય

**ઉત્પાદક**  
સંશોધન નિયામકશ્રી  
જૂનાગઢ ફર્મ યુનિવર્સિટી  
જૂનાગઢ



## પ્રાપ્તિસ્થાન

જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા

કીટકશાસ્ત્ર વિભાગ

જૂનાગઢ ફર્મ યુનિવર્સિટી

જૂનાગઢ

ફોન : ૦૨૮૫-૨૬૭૭૪૮૦